વર્ષ ૪૨, ફેબ્રુઆરી-૨૦૧૧, અંક-૨, આજીવન લવાજમ રૂા. ૨૦૦/-

સંસ્કાર દીપ

: આશીર્વાદ :
પ.પૂ.ગુરુવર્ય શાસ્ત્રીજી
મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી
અખંડ ભગવદ્ પરાયણ પ.પૂ. શ્રી જોગીસ્વામી
પ.પૂ. સદ્ગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી

: પ્રેરણા :
પ.પૂ. સદ્ગુરુ પુરાણી
શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી
: મુદ્રક :
સુર્યા ઓફસેટ, આંબલી, અમદાવાદ-૫૮

: તંત્રી :
શ્રી લક્ષ્મણભાઈ આદ્રોજા
: સંપાદક :
શાસ્ત્રી યજ્ઞવલ્લભદાસજી સ્વામી
: કલા સંયોજન :
ગોવિંદ જી. બાંટવા

: પ્રકાશક :
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ
મેમનગર, અમદાવાદ - ૩૮૦ ૦૫૨
સંપર્ક : (૦૭૯) ૨૭૯૧૨૫૯૧
૯૮૨૫૨૧૦૦૩૮, ૯૮૨૫૩૧૫૦૩૦

ક્યારેક રમૂજ કરતા રે....

શાસ્ત્રી યજ્ઞવલ્લભદાસ

ભગવાન સ્વામિનારાયણ સંતો-ભક્તોને આનંદ આપવા ઘણીવાર રમૂજી ચરિત્રો કરતા અને ભક્તોને લાડ લડાવતા. મહારાજનો સ્વભાવ રમૂજી હતો. માટે પ્રેમાનંદ સ્વામીએ કહ્યું છે “રમૂજ કરતા રે, રાજીવનેણ રૂપાળા.” જ્યારે મહારાજ રીસાય અથવા ઉદાસ થાય ત્યારે ભક્તો મહારાજને પ્રસન્ન કરવા વિવિધ ઉપાયો કરતા તથા મહારાજ પણ ઘણીવાર રમૂજ કરાવતા. અહીં મહારાજના થોડા રમૂજી ચરિત્રોનો આનંદ માણીએ....

મહારજ સંઘ સાથે લઈને ગઢપુરથી વડતાલ જવા નીકળ્યા. મહારાજ સાથે કાઠી દરબારો હતા. ચાલતા ચાલતા રાત્રી થઈ ગઈ પરંતુ ઉતારાની કોઈ વ્યવસ્થા થતી ન હતી. સુરાખાચર આદી કાઠીઓને ભુખ લાગવાથી આકુળ-વ્યાકુળ થતા હતા. મહારાજે આ જોયુ ને કાઠીઓને કહ્યું થોડે દુર કાદીપુર ગલતાનની ગાદીના બાવાઓનો આશ્રમ છે. આપણે ત્યા ઉતારા કરીએ. કાઠીઓ કહે મહારાજ એમને ખબર પડશે કે તમે સ્વામિનારાયણ છો તો જમવાનું તો ઠીક, આશ્રમમાં ઘરવાયે નહીં દે અને ઉપરાંત મારવા દોડશે. મહારાજ કહે તમારે ત્યાં જઈ કઈ બોલવું નહીં, હું તમને ગરમાંગરમ શીરો-પૂરી જમાડીશ. કાઠીઓ કહે ઠીક મહારાજ.

આટલી પૂર્વ તૈયારી સાથે મહારાજે બાવાના આશ્રમનો દરવાજો ખખડાવ્યો. એક બાવાએ આવી દરવાજો ખોલ્યો. રાત્રીનો સમય હોવાથી કોઈના મોઢા દેખાતા ન હતા. બાવાને થયું કોઈ મોટા મહંત લાગે છે જે આટલા બધા શીષ્યો સાથે પધાર્યા છે. બાવાએ પૂછ્યું, “તમે કોણ ?”. મહારાજે કહ્યું, “હમ ગુલતાન કી ગાદી કે મહંત હૈ ઔર યે સભી મેરે શીષ્ય હૈ.” મહારાજના આટલા વચનો સાંભળી અંદર જેટલા બાવાઓ હતા તે બધા દોડતા દોડતા આવ્યા. બધાની ખૂબ આગતા-સ્વાગતા કરી. ગરમ પાણી કરી સહુને નવરાવ્યા. ઢોલીયા ઢાળી સહુને બેસાડ્યા. આશ્રમનો મહંત નમ્રભાવે મહારાજના ઢોલીયા પાસે બેસી ગયો. સર્વ ખબર અંતર પૂછ્યા અને કહ્યું, “ગુરુદેવ ! ઘણા વરસો પછી આપના દર્શન થયાં.”

મહારાજે પૂછ્યું, “અમે તમને સાધુઓ કરવાનું કહ્યુ હતું તે કર્યા કે નહિ ?” મહંત કહે, “હા ગુરુદેવ ! આપની આજ્ઞા પ્રમાણે મે ઘણા સધુઓ કર્યા છે.” મહંતે પોતાના શીષ્યોને બોલાવી મહારાજને સાષ્ટાંગ નમસ્કાર કરાવ્યાં. મહારાજે મહંતને કહ્યું, “તમે અમને રૂ.૧૦૦૦ની હુંડી મોકલી હતી તે મળી ગઈ છે.” મહંત કહે, “ઠીક ગુરુદેવ.” આમ થોડી વાતચીત થઈ ત્યાં દૂધપાક-પુરીની રસોઈ તૈયાર થઈ ગઈ. મહંતે બધાને પંગતમાં બેસાડી ભાવથી પીરસવા લાગ્યો. મહારાજ તથા કાઠી દરબારો એકબીજાને ઠોંહા મારતા જાય ને જમતા જાય. દરબારોને તો આનંદ આનંદ થઈ ગયો. બધાએ ખૂબ પેટ ભરીને ખાધું ને સૂઈ ગયા.

સવારે મહારાજ તથા સૌ દરબારો ચાલવા તૈયાર થયા. મહંતે મહારાજને રોકવા ખૂબ પ્રયત્ન કર્યો. મહારાજ કહે, “અમારે દ્વારકા જવું છે તેથી રોકાવું નથી.” સહુ પોત-પોતાના ઘોડે બેઠા. મહંતે મહારાજને દક્ષિણા આપી ને સહુએ વિદાય લીધી. સહુ દરબારો દૂર જઈ એક સાથે “જય સ્વામિનારાયણ” એમ બોલ્યા. બાવાઓ આ સાંભળી ચમક્યા. તેઓને ખબર પડી કે આ તો સ્વામિનારાયણ છે. આપણી સાથે દગો થયો. સહુ ધોકા, ચિપીયા, ભાલાં વગેરે લઈ મારવા પાછળ દોડ્યા પણ ઘોડેસવારોને થોડા આંબી શકે!

થોડે દૂર જઈ મહારાજ તથા દરબારો ઉભા રહ્યા. ખૂબ પેટ પકડીને હસ્યા.

●●●

મહારાજ દાદા ખાચરના દરબારમાં વિરાજમાન છે. જ્ઞાનની અતિ ગહન વાતો ચાલી રહી છે. લાંબા સમયથી જ્ઞાનવાર્તા ચાલતી હોવાથી સહુને આળસ-નિદ્રા આવવા લાગી. તેથી મહારાજે થોડી રમુજ કરવા જીણાભાઈ આદિ ગરાસીયાઓની હાજરીમાં સુરાખાચરને પૂછ્યું, “સુરા ખાચર ! ગરાસિયા કેવા ?” સુરા ખાચર કહે, “મહારાજ ! ગરાસીઓને નહી કાંઈ મહેનત કરવી ને ન યુદ્ધ ખેલવા, એ તો સહુ આળસુ ને વ્યસની બહુ.” હું બે ગરાસાયીઓની વાત કહું,. “એક ગરાસીયો ગાંજો પીને ડોલવા લાગ્યો. તેથી તેણે

માથે જે પાઘડી પહેરી હતી તે હેઠી પડી ગઈ. તેવા સમયમાં ત્યાંથી કૂતરું નીકળ્યું. એ કૂતરું પાઘડીમાં લઘુશંકા કરીને જતું રહ્યું. કૂતરાની લઘુશંકાથી પાઘડી પલળી ને ઢીલી પડી ગઈ. થોડી આંખ ઉઘડી એટલે ગરાસીયાએ પાઘડી હાથમાં લીધી તો ટાઢું લાગ્યું એટલે બોલ્યો, "આ શું છે ?" ત્યારે બીજો ગરાસીયો કહે, "બાપુ ! એ તો પાઘડી છે" તે સાંભળી ગરાસીયો પાઘડી માથે નાખી ફરી ડોલવા લાગ્યો."

એક બીજો ગરાસીયો હતો. તે બેઠો બેઠો ઊંઘતો હતો. તેના ઘરની દાસી વાસીદું કરતી હતી. તે ભૂલમાં સાવરણાની ઝાપટ ગરાસીયાના મોઢે વાગી. એટલે ગરાસીયો ઊંઘમાં કહે, "કોણ છે ?" ત્યારે દાસી કહે, "એ તો તમારી ઘોડી પૂંછ ઝાટકે છે." એમ ગરાસીયા વ્યસનના બંધાણી બહુ હોય પણ અમે કાઠી તો ભારે શૂરવીર. આ વાત સાંભળી સભા હસવા લાગી.

પણ ઝીણાભાઈથી ન રહેવાયું. તે કહે, "એવું તે હોય કાંઈ? "પણ શૂરવીર તો અમે. પછી એમણે કાઠીની વાત કરી. એક વખત અમારા ગામમાં કાઠીઓએ ધાડ પાડી ને ગામ ભાંગ્યું. ગામને લૂંટી સહુ ભાગવા લાગ્યા. તેઓની પાછળ ગરાસીયાઓ દોડ્યા. તેમાં એક પગપાળો કાઠી ખેડેલી જમીનમાં ભાગવા લાગ્યો. તે જોઈ ગરાસીયો કહે, "ઊભો રહે ! આમ ઉભી પૂંછડીએ ભાગ્ય મા. તારી આબરૂના કાંકરા થાય છે." આ સાંભળી કાઠી કહે, "પાળિયા થાય એના કરતાં કાંકરા થાય તે સારું. હું જો ઉભો રહું તો તમે મારી નાખો તો મારો પાળિયો થાય." આમ ઝીણાભાઈએ કાઠીની ઠેકડી કરી સહુને ચૂપ કરી દીધા.

●●●

એકવાર મહારાજ રીસાઈ ગયા. ન કોઈ સાથે કાંઈ બોલે કે ન ચાલે. બધા સંતો-ભક્તો ખૂબ રીઝવવા પ્રયત્ન કરે પણ બધા નિષ્ફળ. તેવામાં મૂળજી શેઠ મહારાજનાં દર્શને આવ્યા. મહારાજ અવળું જોઈ ગયા. સંતોએ કહ્યું કે, "મહારાજ રીસાયા છે." તે જાણી મૂળજી શેઠે એક રમૂજ વાત કરવા માંડી. શેઠ કહે, "કમલો અને ધમલો વાણિયાના બે દીકરા હતા. બે માળની લાકડાની હવેલીમાં તેઓ રહેતા. એકવાર હવેલીમાં આગ લાગી તે હવેલી બળી ગઈ. કમલો-ધમલો બહાર ગયા હતા. તેની માને ખબર પડતાં તે હવેલીની બહાર નીકળી ગઈ. પરંતુ હવેલીમાં એક કૂતરી સૂતી હશે તે સળગી ગઈ. થોડી વાર પછી કમલો અને ધમલો આવ્યા ને પોતાની માને શોધવા લાગ્યા. તેમના હાથમાં અર્ધ બળેલી કૂતરી આવી. તેને ઝોળીમાં નાખી બાળવા લઈ ગયા. રસ્તામાં કમલો કહે, "ભાઈ ધમલા ! આને તો પૂંછડું છે. આપણી માને પૂછડું તો ન હતું!" ત્યારે ધમલો કહે, "આપણા બાપા ક્યારેક કહેતા કે, "તારી માનું પૂછડું" તે કદાચ આ જ હશે." આ વાત સાંભળી મહારાજ ખૂબ હસવા લાગ્યા.

●●●

ગઢડામાં એક દિવસ મહારાજ બહુ ઉદાસ થઈને સભામાં બેઠા હતા. તે કોઈને બોલાવે નહી ને કોઈની સામું જુએ પણ નહીં. તેથી સંતો તથા ભક્તો બહુ ઉદાસ થઈને બેસી રહ્યા. તે સમયે બ્રહ્માનંદ સ્વામી અને શૂરા ખાચરે ઘણીવાર સુધી ટીખળ અને રમૂજ કરી પણ મહારાજ ઉપર કોઈ અસર ન થઈ. આથી બ્રહ્માનંદ સ્વામી ત્યાંથી ઉઠીને ઉતારે આવ્યા અને ઠકરાણીનો વેશ લઈને, લાજ કાઢીને સભામાં આવ્યા. સભામાં મહારાજ સામું જોતા જોતા બાઈઓ તરફ જવા લાગ્યા. કોઈ અજાણ્યું સભામાં આવતું જાણી બાઈઓ કોણ છે? કોણ છે? એમ બૂમો પાડતા પાડતા આમ-તેમ ભાગવા લાગ્યા. તેથી સ્વામી પાછા વળી સાધુઓની તરફ જવા લાગ્યા. તેથી સાધુઓ પણ "આ કોણ છે? ઉપવાસ પડશે, એને કાઢી મેલો" એવો શોર-બકોર કરવા લાગ્યા. આ સાંભળી બ્રહ્માનંદ સ્વામી પાછા બાઈઓ તરફ જાય અને વળી સાધુ તરફ આવે. એમ બે ત્રણ વાર આવ-જા કરતાં બહુ શોર-બકોર થવા લાગ્યો. તે જોઈ મહારાજ હસ્યા અને સ્વામી સામું જોઈને બોલ્યા કે, "ઠકરાણી ! એકલા કેમ છો?" તે સાંભળી સ્વામી કહે, "ઠાકોરડો રીસાઈને બેઠો છે તેથી એકલા છીએ." આવાં વચનો સાંભળીને મહારાજ, સંતો, પાર્ષદો, બાઈઓ વગેરે ખડખડાટ હસવા લાગ્યા ને મહારાજની ઉદાસી ઉડી ગઈ.

●●●

એકવાર શ્રીજી મહારાજ ખૂબ ઉદાસ થઈ ગયા. કોઈ બાજુમાં જઈ શકે નહીં અને જમવા પણ આવે નહીં. આમને આમ બપોરના બે વાગ્યા સુધી દાદા ખાચરના દરબારમાં કોઈ જમ્યા નહી. દાદા ખાચરના સાળા નાગમાલા નામે શરીરે બહુ કદાવર હતા. તે બીતા બીતા મહારાજ પાસે જમવાનું કહેવા જાય ત્યાં મહારાજ તેની સામે ડોળા કાઢે. એટલે એ પાછા પગે ભાગે અને અંગ મરડીને કેટલાક ટીખળ કરે ને વળી પાછા જમવાનું કહેવા આવે. ફરીથી મહારાજ ડોળા કાઢે ને પાછા ભાગે ને ફરી ટીખળ કરે. છતાં મહારાજ રાજી ન થાય.

દાદા ખાચરે આ વાત બ્રહ્માનંદ સ્વામીને જણાવી. તેથી સ્વામીએ મહારાજને મનાવવા આખા શરીરે રાખ લગાડી. કેડે સીંદરી બાંધી અને સીંદરીમાં ઠીકરાના પાટુડા, દોણકા, લોટકાં ને નાના હાંડલાં બાંધ્યા. પગે ઘૂઘરા બાંધ્યા. કેડમાં ઘૂઘરમાડ માંધી. મોટું જાડું ધોકા જેવું હરણનું શિંગડું લીધું. માથે ભીંડીની જટા અને ભીંડીની દાઢી બાંધી. હાથમાં ચિપીયો અને એક ભગવી ધજા લીધી. આવો વેશ લઈને મહારાજ પાસે આવ્યા. નમસ્કાર કરીને બોલવા માંડ્યા, "નમો સહજાનંદે, નમો નિત્યાનંદે, નમો મુક્તાનંદે, નમો નાગમાલાને, નમો નાગમાલાના ચૂલાને, નમો નાગમાલાના ફૂલાને." આમ બોલીને જ્યાં નાગમાલો વાંકો વાંકો ચાલીને અંગ મરડીને ટીખળ કરતો હતો તેના માથે હાંડલું ફોડ્યું. પછી નાગમાલાને પ્રદક્ષિણા કરીને ઉપર પ્રમાણે બોલીને ફરીથી માથે હાંડલું ફોડે, ઘૂઘરા વગાડે, ચિપીયો પછાડે અને ત્રીજી વખત ઉપરનું પદ બોલ્યા. ફરીથી માથે હાંડલું ફોડે, ઘૂઘરા ખખડાવે, ચિપીયો પછાડે અને ઉંચે સાદે બોલે, "અલેખ !"

આ જોઈ શ્રીહરિ હસવા માંડ્યા.

●●●

સંસ્થા સમાચાર

ગુરુકુલ પરિવાર સ્નેહ મિલન (રાજકોટ) :-

તા. ૧૮/૧૨/૧૦, શનિવારના રોજ રાજકોટ મુકામે નિવાસ કરતા ગુરુકુલ પરિવારના તમામ સુહૃદજનોનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ઠાકોરજીના પૂજન બાદ પ.પૂ.સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પોતાના પ્રવચન દ્વારા પૂજ્ય ગુરુદેવના અણમુલા વારસાને સાચવી રાખવા સૌને ભલામણ કરી હતી. પ.પૂ. સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ઈષ્ટદેવ, શાસ્ત્ર અને સદ્‌ગુરુ એ ત્રણને પોતાના જીવનના આધાર બનાવવાની વાત કરીને સૌને પ્રેરણા પાઠવી હતી. આ સ્નેહ મિલનમાં રાજકોટના સ્વયંસેવકોએ ખૂબજ જહેમત ઉઠાવીને આમંત્રણ, ભોજનપ્રસાદ તથા સભાની સુંદર વ્યવસ્થા ગોઠવી હતી.

અમૃતસર, પંજાબ (૨૫ ડિસેમ્બર) :-

અમૃતસર પાસેના કાદિયાન ખાતે અહમદિયા પંથનું ઉદ્‌ગમ સ્થાન છે. અહમદિયા પંથના લાખો અનુયાયીઓ વિશ્વભરમાં ફેલાયેલા છે. ગુલામ અહમદ સાહેબે આશરે ૩૦૦ વર્ષ પહેલા અહમદિયા પંથની સ્થાપના કરેલી છે. હાલમાં લંડન વસતા હજરત મસરુર અહમદ સાહેબ અહમદિયા પંથના વડા ધર્મગુરુ છે.ભારત ખાતે જનાબ મુહમ્મદ ઈનામ ગૌરી સાહેબ અહમદિયા પંથનું સંચાલન કરી રહ્યા છે. તેઓશ્રીની અધ્યક્ષતામાં અમૃતસર પાસેના કાદિયાન ગામે વિશાળ સંમેલન ભરાયું હતું.દેશ વિદેશમાંથી હજારો મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતા.જેમાં પાકિસ્તાનમાંથી આશરે ૯ હજાર મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશના કન્વીનર શ્રી ફઝલુ રહેમાનના આગ્રહથી સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, હિન્દુ ધર્માચાર્ય મહાસભાના મંત્રી શ્રી પરમાત્માનંદજી મહારાજ તથા જામનગર પ્રણામી સંપ્રદાયના વડા શ્રી કૃષ્ણમણિજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમૃતસર ગોલ્ડન ટેમ્પલ-સુવર્ણ મંદિર ના વડા જ્ઞાની ગુરુમિતસિંગજી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરમાત્માનંદજી મહારાજ, સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સંતોએ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી હતી.

વર્લ્ડ પોલિસ યુનિટી ટુર- SGVP :-

તા.૮/૧/૧૧ના રોજ સ્વર્ણીમ ગુજરાત વર્ષ પ્રસંગે આયોજિત 'સરદાર પટેલ વર્લ્ડ પોલિસ યુનિટી ટુર' પ્રસંગે અમેરિકાથી પધારેલ પોલિસ ઓફિસર તેમજ ગુજરાતના પોલિસ ઓફિસરો અને ટુરના આયોજકોનો ભાવપૂર્ણ સ્વાગત સમારોહ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્, છારોડી ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરના વિદ્યાર્થીઓએ ભકિતસભર નૃત્ય નાટિકા તેમજ રાષ્ટ્ર ભકિતથી ભરપુર વન્દે માતરમ્ કાર્યક્રમ રજુ કરી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત દર્શકોના મન જીતી લીધા હતા. આ પ્રસંગે પ.પૂ સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત વિમાનની ઝડપે વિકાસ સાધી રહ્યું છે.

ધનુર્માસ SGVP :-

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, છારોડીમાં દેશ-વિદેશના પાંચસો વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહી અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિના રીત-રિવાજો તેમજ સાંપ્રદાયિક પ્રણાલીના સંસ્કારો આપવામાં આવે છે. ધનુર્માસ દરમિયાન આ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ઉત્સવો તેમજ વિવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પ. પૂ. શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામીએ ભાગવતના દશમ સ્કંધની કથા કરેલ તથા ફલકૂટોત્સવ, તુલસી વિવાહ, સંતોની છાત્રાલયમાં પધરામણી, મંત્રલેખન, સમૂહ મહાપૂજા, વિષ્ણુયાગ, મેમનગરથી કાલુપુર મંદિર પદયાત્રા જેવાં ધાર્મિક આયોજનો તેમજ ગરીબોને ધાબળા વિતરણ, હોસ્પીટલમાં દર્દીઓને ફળોનું વિતરણ, વસ્ત્રોનું વિતરણ, અનાથાશ્રમમાં ગરમ કપડાંઓનું વિતરણ, વૃદ્ધાશ્રમમાં વડીલોની મુલાકાત જેવાં સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનો શારીરિક વિકાસ થાય તે માટે 'પ્રેમપ્રકાશ સ્પોર્ટસ્ મીટ' અને સંગીત સંધ્યાનું આયોજન તેમજ વિવિધ તીર્થસ્થળોનો મહિમા સમજાય તે માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય ગૌરવ :-

તા. ૯ થી ૮ જાન્યુઆરી, ૨૦૧૧ દરમિયાન 'પૂર્ણપ્રજ્ઞ વિદ્યાપીઠ, બેંગલોર' ખાતે રાષ્ટ્રિય સંસ્કૃત સંભાષણ સ્પર્ધાનું આયોજન રાષ્ટ્રિય સંસ્કૃત સંસ્થાન દ્વારા થયું. જેમાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા શાસ્ત્રી મુનિવત્સલદાસજી સ્વામી મીમાંસા વિષયમાં દ્વિતીય સ્થાન, જોષી ધરમ ધર્મશાસ્ત્ર વિષયમાં તૃતીય સ્થાન અને જોષી વિજય ન્યાયશાસ્ત્રમાં તૃતીય સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

સત્સંગ વિચરણ :-

ધનુર્માસ નિમિત્તે તા. ૨૦ ડિસેમ્બર ૨૦૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૧૧સુધી શાસ્ત્રી શ્રી વેદાંતસ્વરુપદાસજી સ્વામી, પૂ. કૃષ્ણજીવનદાસજી સ્વામી તથા પૂ. પ્રેમજીવનદાસજી સ્વામીએ વાપી, નાગપુર, મુંબઇ- દહિંસર, કાંદીવલી, ભાયંદર, વાસી, પનવેલ, મીરારોડ, ભૂલેશ્વર જેવા વિવિધ મંદિરોમાં સત્સંગનો લાભ આપી હરિભક્તોને રાજી કર્યા હતા. તા. ૨૩ના રોજ વાપી ખાતે પાટોત્સવ પ્રસંગે પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ પધારી સત્સંગ-કથાવાર્તાનો લાભ આપ્યો હતો તથા નાગપુર સત્સંગ સત્રમાં પધારી કથાવાર્તાનો લાભ આપ્યો હતો. નાગપુર કચ્છી કડવા પાટીદાર સમાજમાં પૂ. સદ્‌ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના સાનિધ્યમાં યોજાયેલ શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહી શાસ્ત્રી શ્રી વેદાંતસ્વરુપદાસજી સ્વામીનું પિતૃ વંદના ઉપર વ્યાખ્યાન સાંભળી સહુ શ્રોતાજનો ભાવવિભોર થયા હતા.

"SANSKARDIP" R.N.I. 15104/68 Permitted to post at Ahd. PSO on 9th of every month. Registered under Postal Reg. No. GAMC-1729/2010-2012 valid up to 31-12-2012 issued by SSP Ahmedabad-9 Licenced to post without Prepayments No. CPMG/GJ/85/10-12/valid upto 31-12-2012

અમૃતસર પાસેના કાદિયાન ખાતે યોજાયેલ સમ્મેલનમાં પ્રવચન આપતા પ. પૂ. સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી

ગરીબોને ધાબળા વિતરણ કરતા વદ્યાર્થીઓ

કચ્છી લેવા પટેલ સમાજ, નાગપુર ખાતે સભામાં પૂ.સંતો

પ. પૂ. સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સાથે વર્લ્ડ પોલીસ ટૂરના સભ્યો

If undelivered Please
Return to:
Shree Swaminarayan Gurukul
Gurukul Road, Memnagar,
Ahmedabad - 380052

To.